https://archive.org/details/bk1410/page/n0/mode/1up

2013-05 -Satpanth Prakash (1410)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

વર્ષ : ૨, અંક : ૩, સળંગ અંક : ૧૫, દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતું માસિક મે : ૨૦૧૩

સતપંથ પ્રકાશ

સં. ૨૦૬૯ના ચૈત્ર સુદ-૨, શુક્રવાર, તા. ૧૨-૪-૨૦૧૩ના અમૃત મહોત્સવ (સંઘમેળા) પ્રસંગે પદયાત્રીઓનાં સ્વાગત-સામૈયાં માટે જઈ રહેલ પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો-મહંતો તેમજ હરિભક્તો

છૂટક કિંમત - રૂા. ૭/- વા.લ. રૂા. ૮૦/-

realpatidar.com

https://archive.org/details/bk1410/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 4, 5, 6.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1410/page/n2/mode/1up

2013-05 -Satpanth Prakash (1410)

Real Patidar
Unravel Truth

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 14:55:52 +05'30'

વર્ષ : ૨, અંક : ૩, સળંગ અંક : ૧૫, દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતું માસિક મે : ૨૦૧૩

સતપંથ પ્રકાશ

સં. ૨૦૬૯ના ચૈત્ર સુદ-૨, શુક્રવાર, તા. ૧૨-૪-૨૦૧૩ના અમૃત મહોત્સવ (સંઘમેળા) પ્રસંગે પદયાત્રીઓનાં સ્વાગત-સામૈયાં માટે જઈ રહેલ પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો-મહંતો તેમજ હરિભક્તો

છૂટક કિંમત - રૂા. ૭/- વા.લ. રૂા. ૮૦/-

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1410/page/n3/mode/1up

Shivji Kaka

realpatidar.com

જાહેર આમંત્રણ

સતપંથ પ્રેરણાપીઠના એકવીસમા ગાદીપતિ

પ.પૂ. બ્રહ્મલીન આચાર્યશ્રી સવજીદાસજી મહારાજની સત્તાવીસમી પુણ્યતિથિ મહોત્સવ

પ્રેરણાપીઠ - પીરાણા, તા. દસક્રોઈ, જી. અમદાવાદ. (તા. ૪-૬-૨૦૧૩)

પ.પૂ. બ્રહ્મલીન આચાર્યશ્રી સવજીદાસજી મહારાજના શિષ્યમંડળ તેમજ ભાવિક ભક્તજનો જોગ

● પ.પૂ. બ્રહ્મલીન આચાર્યશ્રી સવજીદાસજી મહારાજ ●

સહર્ષ જણાવવાનું કે શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીની કૃપા અને સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની પ્રેરણાથી, પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજના આશીર્વાદથી પ.પૂ. બ્રહ્મલીન આચાર્યશ્રી સવદાસજી મહારાજની સત્તાવીસમી પુણ્યતિથિ ઉજવવાનું આયોજન સં. ૨૦૬૯, વૈશાખ વદ - ૧૧ને મંગળવાર, તા. ૪-૬-૨૦૧૩ના દિવસે શ્રી પ્રેરણાપીઠ - પીરાણા મધ્યે રાખવામાં આવેલ છે. તો સૌ શિષ્યમંડળ તથા ધર્મપ્રેમી ભાવિક ભક્તજનોને મહોત્સવનો ધર્મલાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.

:: કાર્યક્રમસૂચિ ::

તા. ૩-૬-૨૦૧૩ સોમવાર	: સાંજે	: ૮-૪૫	કલાકે	: ભજન-સત્સંગ (ગુરુવર્યની સમાધિ સ્થળે)
તા. ૪-૬-૨૦૧૩ મંગળવાર	: સવારે	: ૬-૦૦	કલાકે	: અલ્પાહાર
	સવારે	: ૭-૦૦	કલાકે	: પ.પૂ. બ્રહ્મલીન મહારાજનાં પૂજન-અર્ચન-આરતી
	સવારે	: ૮-૦૦	કલાકે	: પ્રાસંગિક પ્રવચનો અને મંતવ્યો
	સવારે	: ૯-૦૦	કલાકે	: મહાપૂજા, શિષ્યમંડળ પરિચય
	બપોરે	: ૧૧-૦૦	કલાકે	: બ્રહ્મભોજન-મહોત્સવ પૂર્ણાહુતિ

નિમંત્રક
બ્રહ્મલીન પ.પૂ. આચાર્યશ્રી
સવજીદાસજી મહારાજના શિષ્યમંડળ વતી,
પ.પૂ. મહંતશ્રી રવિદાસજી મહારાજ
- પ્રેરણાપીઠ, પીરાણા.

સંપર્ક : શ્રી રમણભાઈ માધાભાઈ પટેલ : મો. ૦૯૮૨૫૦૬૨૬૬૮
શ્રી સુરેશભાઈ મેઘજીભાઈ પટેલ : મો. ૦૯૪૨૬૮૯૦૨૬૨
શ્રી જશુભાઈ દેવશીભાઈ પટેલ : મો. ૦૯૪૨૭૦૮૧૬૮૮

realpatidar.com

https://archive.org/details/bk1410/page/n4/mode/1up

realpatidar.com

સતૂપંથ પ્રકાશ | મે - ૨૦૧૩

વર્ષ : ૨, અંક : ૩, સળંગ અંક : ૧૫

સતૂપંથ પ્રકાશન સમિતિ

સંપાદકશ્રી :
શ્રી શામજીભાઈ કે. પટેલ (વડાગામ)
સહ સંપાદકશ્રી :
શ્રી બાબુભાઈ એસ. પટેલ (મેઘપંપા)
મંત્રીશ્રી :
શ્રી જસુભાઈ કે. પટેલ (વિઠ્ઠલપુરાલાટ)
સહમંત્રીશ્રી :
શ્રી સુરેશભાઈ એમ. પટેલ (અમદાવાદ)
સલાહકારશ્રીઓ :
શ્રી છગનભાઈ એસ. પટેલ (વડોદરા)
શ્રી શામજીભાઈ એલ. પટેલ (વડોદરા)
સદસ્યશ્રીઓ :
શ્રી પ્રિ. સુરેશભાઈ એસ. પટેલ (ખેડબ્રહ્મા)
શ્રી કરસનભાઈ વી. પટેલ (ધનસુરા)
શ્રી મનોજભાઈ એન. પટેલ (વડોદરા)
શ્રી જેઠાલાલ કે. સેંઘાણી (મેરાઉ)
શ્રી અમૃતલાલ જે. રૂડાણી (નાના અંગીયા)
શ્રી બાબુભાઈ એચ. પટેલ (અમરગઢકંપા)
શ્રી હર્ષદકુમાર જે. પટેલ (પીરાણા લાટ)

સતૂપંથ પ્રકાશ - લવાજમ દર

		ભારતમાં		વિદેશમાં
વાર્ષિક	:	૮૦=૦૦	:	૭૦૦=૦૦
ત્રિવાર્ષિક	:	૨૨૦=૦૦	:	૧૮૦૦=૦૦
આજીવન	:	૭૫૦=૦૦	:	૪૦૦૦=૦૦
અમર	:	૧૫૦૦=૦૦	:	૭૦૦૦=૦૦

પ્રકાશક

સતૂપંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ-૩૮૨૪૨૫. ફેક્સ : ૦૨૭૧૮-૨૮૮૮૭૨
સંપર્ક : ધર્મેન્દ્ર પટેલ - બુકસ્ટોલ મો. ૯૪૨૭૩૭૧૯૪૦ ફોન: ૦૨૭૧૮-૨૮૮૮૧૨

E-mail : kutchkadavasssamajtrust@yahoo.in
kkp_pirana@yahoo.com
(Contact : Mob. No. 9427701112)

Website : www.satpanth.org
www.satpanthprakashan.org
www.nishklankinarayan.com

કુરીયર્સ : હિમેશ પટેલ - મો. ૯૯૭૪૬૬૪૨૭૪ / આશિષ પટેલ : ૯૯૭૪૪૯૦૦૦૨

સત્યમ ઓટો કન્સલટન્ટ
૧-એ, જયવિજય સોસાયટી, ઓ.-પલીયડનગર ગાર્ડન, પલીયડ નગર
સોસાયટીની નજીક, નારણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩
C/o. સતૂપંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા.

મુદ્રક : સ્મૃતિ ઓફસેટ : બી-૫/૬/૭, રવિ એસ્ટેટ, રૂસ્તમ મિલ કંપાઉન્ડ, ટોરેન્ટો પાવરની બાજુમાં, દુધેશ્વર, અમદાવાદ-૩૮૦૦૦૪, ફોન : (૦૭૯) ૨૫૬૩૦૩૭૨/૭૩

મૂળ ક્રમ : વર્ષ : ૨૦, અંક : ૭, સળંગ અંક : ૨૩૫

સંપાદકીય.....

પ્રેરણા

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય વિજયેતેતરામ ॥

જે માણસ "કામ કમ ઔર બાતેં અધિક" ના સિધ્ધાંત પર ચાલે છે અને જે લોકોને આળસુ બનાવે છે તે માણસ તમોગુણી અને રજોગુણી પ્રવૃત્તિ કરે છે. આળસ અને ખોટા (વ્યર્થ) વાર્તાલાપથી બચવા હંમેશાં કાર્યશીલ રહેવું જોઈએ. આપણે આવા દુર્ગુણોથી દૂર રહીએ અને શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપીએ જેથી બધે આપણા જ્ઞાનની ચર્ચા થાય.

આપણે આપણાં બાળકો, આશ્રિતો અને સહયોગીઓને આળસથી દૂર રહેવાનું શિક્ષણ આપવું જોઈએ. તેઓની સામે એક ઉદ્યમી, સંયમી માણસનાં ઉદાહરણ રજૂ કરવાં જોઈએ. બાળપણથી જ એમનામાં સદ્‌ગુણોનાં બીજા રોપણ કરતા રહેવું જોઈએ. આ એક દિવસનું કામ નથી પરંતુ સતત પ્રક્રિયા કરવી પડે છે. બાળમાનસ બહું સરળતાથી દોષ-દુર્ગુણોના પ્રલોભનમાં ફસાઈ જાય છે. પૂરી સતર્કતાથી આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓમાં દુર્ગુણો ઉત્પન્ન થાય નહીં. એક સજાગ ખેડૂતની માફક દર સમયે ખેતરમાંથી નિંદામણ કરી સફાઈ કરતા રહેવું જોઈએ. દુર્ગુણોને શરૂઆતમાં જ કચડી નાખી તેઓને વધતા જ અટકાવી દેવા જોઈએ.

બાળકોને હંમેશાં સત્કર્મો તરફ જ પ્રેરિત કરતા રહીને તેઓને રચનાત્મક કામોમાં લગાવવાં જોઈએ. જેથી તેઓ સમાજમાં એક શ્રેષ્ઠ નાગરિકના રૂપમાં યશસ્વી બની શકે. સંતાનોને સુસંસ્કારી અને સદ્‌ચારિત્ર્યવાન બનાવવા માટે માતાપિતાએ પોતાનાં સુખ સગવડોનો ત્યાગ અને બલિદાન આપવું જોઈએ. પોતાના દોષ-દુર્ગુણોને બહાર કાઢી એક આદર્શ પ્રસ્તુત કરવાનો હોય છે જેથી તેનો પ્રભાવ આપણાં બાળકો પર રહી શકે. આળસ અને નિરર્થક વાતોથી બાળકોને બચાવવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.

સંપાદક : શ્રી શામજીભાઈ કે. પટેલ

realpatidar.com

https://archive.org/details/bk1410/page/n5/mode/1up

2013-05 -Satpanth Prakash (1410)

Satpanth Religious Literature - Sadguru Vaani

realpatidar.com

એક તજો રે સંગ કુસંગીયા, તમે છોડો સંગ-કુસંગ રે,
પોતાના પ્રપંચ પરહરી, અને નેહ સ્વામીજી સું લાવો રે.
પિતા હોવે તેણે તજીયે, જેના હરિ સુ નહીં રંગ રે,
આપ ડૂબેને બીજાને ડૂબાવે, તેસુ ન કરીયે વહેવાર રે.
આગે જુઓને રાજા પ્રહલાદ હતા, તેણે પિતા તજ્યા તત્કાલ રે,
શ્રી નરસિંહનાં ચરણ ભેટીયાં, સારીયાં પોતાનાં કાજ રે.
માતા હોવે તેણે તજીયે, જેના હરિ સુ નહીં રંગ રે,
આપ ડૂબેને બીજાને ડૂબાવે, તેસુ ન કરીયે વાત રે.
આગે જુઓને ભરત-શત્રુઘ્ન હોતા, તેણે માતા તજ્યાં તત્કાલ રે,
શ્રી રામનાં ચરણ ભેટીયાં, સારીયાં પોતાનાં કાજ રે.
ભાઈ હોવે તેણે તજીયે, જેના હરિ સુ નહીં હેત રે,
આપ ડૂબેને બીજાને ડૂબાવે, તેસુ ન કરીયે વાત રે
આગે જુઓને ભક્ત વિભીષણ હોતા, તેણે ભાઈ તજ્યા તત્કાલ રે,
શ્રી રામનાં ચરણ ભેટીયાં, સારીયાં પોતાનાં કાજ રે.
નારી હોવે તેણે તજીયે, જેના હરિ સુ નહીં રંગ રે,
આપ ડૂબેને બીજાને ડૂબાવે, તેસુ ન કરીયે વાત રે.
આગે જુઓને ભક્ત શ્રવણ હોતા, તેને નારી તજી તત્કાલ રે,
મા-બાપને કાશી પહોંચાડ્યાં, સારીયાં પોતાનાં કાજ રે.
પુત્ર હોવે તેને તજીયે, જેના હરિ સુ નહીં હેત રે,
આપ ડૂબેને બીજાને ડૂબાવે, તેસુ ન કરીયે વાત રે.
આગે જુઓને રાજા ઊગ્રસેન હોતા, તેણે પુત્ર તજ્યા તત્કાલ રે,
શ્રી કૃષ્ણનાં ચરણ ભેટીયાં, સારીયાં પોતાનાં કાજ રે.
કુસંગ હોવે તેણે તજીયે, તમે હૃદયે વિચારો જ્ઞાન રે,
તે સોનુ સુ પહેરીયે રે, જે સોનાથી તૂટે છે કાન રે.
એક પડોશીનાં લક્ષણ ભૂંડાં, કુડ ચઢાવે આળ રે,
તેણે હળવે હળવે છોડીયે, જેમ સરોવર છોડસે પાળ રે.
કહેત ઈમામશાહ સાંભળો ભાઈ, સત્ય વચન પરમાણો રે,
પોતાના પ્રપંચ પરહરી, અને નેહ સ્વામીજી સુ લાવો રે.

•

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

Chandan Vidhi - Nayaji Maharaj - Kukas

realpatidar.com

ચંદનવિધિ - સંઘ મહોત્સવ

(સંતશ્રી નાયાજી મહારાજ સંસ્થા - કુકસ - તા. ૨૩-૪-૨૦૧૩)

- દક્ષા ડી. પટેલ.

શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીની અસીમ કૃપાથી સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની તેમજ સંતશ્રી નાયાજી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ. જગદ્ગુરુ સત્પંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજના આશીર્વાદથી શ્રી નાયાજી મહારાજ સંસ્થામાં ચંદનવિધિ - સંઘ મહોત્સવનો કાર્યક્રમ તા. ૨૩-૪-૨૦૧૩, મંગળવારના રોજ કુકસ ધામે યોજાઈ ગયો.

સવારના પાંચ વાગ્યે પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજ દ્વારા મહાપૂજા કરવામાં આવી. ત્યારબાદ કાનમ વિસ્તાર, સુરત, ભરૂચ, ચાણોદ, નરસંડા, મેવાસ, તેમજ આજુબાજુના વિસ્તારના પદયાત્રીઓ સવારથી ભજન-કીર્તન સાથે કુકસ ધામે પધાર્યા. કુકસ ગામના પટેલ નરેશભાઈ ચુનીભાઈએ પદયાત્રીઓનું ચંદન તિલક કરી ધર્મધ્વજાને વધાવી ફૂલહાર કરી સ્વાગત કર્યા.

બપોરના ૩-૦૦ કલાકે પદયાત્રીઓના સામૈયા માટે શોભાયાત્રા કાઢવામાં આવી. પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજ, દિવાળીપુરાથી પધારેલ પ.પૂ. મહંતશ્રી સોમદાસજી મહારાજ તેમજ પૂ. પંડિત શ્રી છગનબાપા અને કુકસ ગામના પૂજારી શ્રી કાંતિદાસજી મહારાજ તેમજ દરેક હરિભક્તો ભજન કીર્તન સાથે શોભાયાત્રામાં જોડાયા. ત્યારબાદ પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજે દરેક પદયાત્રીઓને ચંદન-તિલક કરી ફૂલહારથી વધાવ્યા બાદ ભજન કીર્તન સાથે સૌ નાયાજી મહારાજના મંદિરે આવ્યા. ગામની બહેનો તથા નરસંડાની બહેનો દ્વારા ભજન કીર્તન કરી શોભાયાત્રાને દિપાવી. દરેક હરિભક્તોએ આનંદ અને ઉલ્લાસથી કાર્યક્રમને શોભાવ્યો.

ત્યારબાદ સૌ સંતોએ આદ્યશક્તિ માતાની જ્યોત પ્રાગટ્ય કરી મંચ પર સ્થાન ગ્રહણ કર્યા. ત્યારબાદ પધારેલ સંતોનું ચંદન-તિલક-ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. કુકસ ગામની બાળાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી.

ત્યારબાદ <u>પૂ. છગનબાપાએ કહ્યું કે</u> ; જેનું મન બગડે તેનું તન બગડે, જેનું તન બગડે તેનું ધન બગડે, જેનું ધન બગડે તેનું જીવન બગડે, જીવન બગડે તેનો ભવ બગડે. તે દૃષ્ટાંત આપી ઘણું સમજાવ્યું હતું.

ત્યારબાદ <u>પૂ. મહંતશ્રી સોમદાસજી મહારાજે</u> દરેક હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.

<u>પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજે</u> ચંદન વિધિની સમજણ આપી, સંત નાયાજી મહારાજ કોણ હતા અને લૂંટારામાંથી સંત કેવી રીતે બન્યા તે સમજાવ્યું હતું. મહારાજે બાળકોના સંસ્કારો વિશે ઘણી બધી સમજ આપી. ૧૨ વર્ષના બાળક હાર્દિક રાણાએ આસનો બતાવ્યાં. આમ યોગ ભગાડે રોગ તેના વિશે સમજાવ્યું. છેલ્લે મહારાજશ્રીએ પદયાત્રીઓ અને હરિભક્તોને ભાવવિભોરથી આશીર્વાદ પાઠવ્યા. છેલ્લે ભોગીલાલભાઈએ આભાર વિધિ વ્યક્ત કર્યા બાદ મહાપ્રસાદી લઈ રાત્રે સાડા આઠ વાગ્યે ચંદનવિધિ કરવામાં આવી. ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા. આ વર્ષે આઠસોથી વધુ સંખ્યામાં હરિભક્તોએ પદયાત્રામાં ભાગ લીધો. છેલ્લે મહાપૂજા કરવામાં આવી અને દરેક હરિભક્તો છૂટા પડ્યા હતા.

•

realpatidar.com

https://archive.org/details/bk1410/page/n7/mode/1up

Sanghmelo

realpatidar.com

અમૃત મહોત્સવ (સંઘમેળો) - પ્રેરણાપીઠ-પીરાણા, અમદાવાદ.

સં. ૨૦૬૯ના ચૈત્ર સુદ -૨, શુક્રવાર, તા. ૧૨-૪-૨૦૧૩

ઉપરોક્ત પ્રસંગે પદયાત્રીઓનાં સ્વાગત-સામૈયાં કરતાં પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં બિરાજમાન સંતો-મહંતો

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં સંતોનાં ચંદન-તિલકથી પૂજન કરતા ટ્રસ્ટીશ્રી મણીભાઈ પટેલ

ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં બિરાજમાન ભાવિક હરિભક્તો

realpatidar.com

https://archive.org/details/bk1410/page/n8/mode/1up

realpatidar.com

Registered under RNI No. GUJ - GUJ - 2012/42296. Dt. 18/05/2012.
Registered Under Postal Registration No. GAMC - 1830-2012-2014 By S.S.P. Ahmedabad City DN
Valid up to 31st December 2014. Posted on 15th Every Month from PSO Patrika Channal Ahmedabad - 380002.
દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતુ માસિક

આ અંકના વિશિષ્ટ સહયોગી જ્ઞાનદાતા

"સત્પંથ પ્રકાશ"ના મે - ૨૦૧૩ના અંક માટે રૂા. ૧૧૧૧૧/- (અંકે રૂપિયા અગીયાર હજાર એકસોને અગીયાર)નો આર્થિક સહયોગ "જ્ઞાનદાતા" શ્રી શ્રીકેષભાઈ ડી. પટેલ - મુ. ભીમપોર, જી. સુરત તરફથી પ્રાપ્ત થયેલ છે. સત્પંથ પ્રકાશન સમિતિ તેઓશ્રીના આ "જ્ઞાનદાન"નો સહર્ષ સ્વીકાર કરે છે.

શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન અને સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની કૃપા સદાય તેમના ઉપર રહે તેવા પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તથા સંપાદક શ્રી શામજીદાદાના અભિનંદન સહ આશીર્વાદ.

રવાના :
સતપંથ પ્રકાશ
સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.

To, ______________________

Printed, and Published by **SHAMJIBHAI K. PATEL on behalf of Satpanth Prakashan Samiti** and Printed at **Smruti Offset,** B/5, Ravi Estate, Rustom Mill Compound, Near Torrent Power, Near Water Tank, Dudheshwar, Ahmedabad - 380 004 and published from Satpanth Prakashan Samiti, Shri Satpanth Premapith, At - PIRANA - 382 425, Taluka - Dascroi, Dist. Ahmedabad.
Editor - **SHAMJIBHAI K. PATEL**

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com